



ગુજરાત યુનિવર્સિટી

યુવક કલ્યાણ વિભાગ, નવરંગપુરા, અમદાવાદ -૯.

યુ.ક. નં/૦૯૪/૨૦૧૭

તા:૦૨/૦૨/૨૦૧૭

વિષય: જંગલ પરીભ્રમણ (બહેનો માટે - મા. આબુ) અને હિમાલય પરીભ્રમણ (ભાઈઓ માટે - કુલુ-મનાલી) - ૨૦૧૭

આચાર્યશ્રી/અધ્યક્ષશ્રી,

આપને જાણીને આનંદ થશે કે શિબિરોની સફળતા અને વિદ્યાર્થીઓમાં પ્રસરેલી રૂચી જોઈ આગામી ઉનાળાની રજાઓમાં અનુકૂળતા મુજબ જંગલ પરીભ્રમણ (બહેનો માટે) (મા. આબુ) અને હિમાલય પરીભ્રમણ (કુલુ-મનાલી) વિદ્યાર્થી ભાઈઓ માટે યોજવાનું વિચારણા હેઠળ છે.

(1) જંગલ પરીભ્રમણ (બહેનો માટે - મા. આબુ):

ચાલુ વર્ષે આગામી ઉનાળું વેકેશનમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ફક્ત વિદ્યાર્થીની બહેનો માટે જંગલ પરીભ્રમણ (મા. આબુ) નું આયોજન કરવા વિચારણાધિન છે. આથી આપની કોલેજના શિબિરમાં જોડાવા ઉત્સુક, ખડતલ, નીડર તેમજ સાહસિક ત્રણ વિદ્યાર્થીની બહેનોના નામ આ સાથે જોડેલ એપ્લિકેશન ફોર્મમાં ઝેરોક્ષ કરાવીને કોલેજના ફોરવર્ડિંગ લેટર સાથે તા: ૦૯/૦૩/૨૦૧૭ સુધીમાં આ કાર્યાલયને મળે તે પ્રમાણે મોકલી આપશો. (ગર્લ્સ કોલેજો છ વિદ્યાર્થીની બહેનોના નામો મોકલી શકશે.)

(2) હિમાલય ટ્રેકિંગ (ભાઈઓ માટે - કુલુ-મનાલી):

ચાલુ વર્ષે આગામી ઉનાળું વેકેશનમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ફક્ત વિદ્યાર્થી ભાઈઓ માટે હિમાલય પરીભ્રમણ (કુલુ-મનાલી) નું આયોજન કરવા વિચારણાધિન છે. જેઓએ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉ યોજાયેલ ઓછામાં ઓછી એક શિબિરમાં ભાગ લીધેલ હોય તેવા વિદ્યાર્થીઓજ હિમાલય પરીભ્રમણ (કુલુ-મનાલી)માં ભાગ લઈ શકશે. આથી આપની કોલેજના શિબિરમાં જોડાવા ઉત્સુક, ખડતલ, નીડર તેમજ સાહસિક બે વિદ્યાર્થી ભાઈઓના નામ તેઓએ ભાગ લીધેલ કેમ્પના સર્ટિફિકેટ સાથે, જોડેલ એપ્લિકેશન ફોર્મમાં ઝેરોક્ષ કરાવીને કોલેજના ફોરવર્ડિંગ લેટર સાથે તા: ૦૯/૦૩/૨૦૧૭ સુધીમાં આ કાર્યાલયને મળે તે પ્રમાણે મોકલી આપશોજી. ફક્ત બે વિદ્યાર્થી ભાઈઓના નામોજ મોકલી આપવાના રહેશે.

એન.સી.સી.માં વિશિષ્ટ સ્થાન કે વધુ રસ ધરાવતા તેમજ શિબિર જીવનની અગવડતાઓ વેઠવા તૈયાર હોય તેવા વિદ્યાર્થીઓને આપને યોગ્ય લાગે તો પ્રાથમિકતા આપવા સુચન છે. ઉપરોક્ત શિબિરો માટેની વિદ્યાર્થીઓની આખરી પસંદગી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે. તથા શિબિરો દરમ્યાન જો કોઈ અકસ્માત થાય કે બીમાર પડે તો તેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે અને સારવારનો પુરેપુરો ખર્ચ પણ જે તે વિદ્યાર્થીએ ભોગવવાનો રહેશે. શિબિર સ્થળે વિદ્યાર્થીઓએ રીપોર્ટિંગ કરવાનું રહેશે તથા શિબિર સ્થળે આવવા-જવાનો ખર્ચ વિદ્યાર્થીઓએ પોતે અથવા કોલેજ ભોગવવાનો રહેશે. જ્યારે યુનિવર્સિટી તરફથી રહેવા, જમવા તથા તાલીમની સગવડ શિબિરના સ્થળે કરવામાં આવશે. ઉપરોક્ત શિબિરોના સંચાલક તરીકે મ. નિયામક, યુવક કલ્યાણ કે તેમના પ્રતિનિધિ રહેશે.

આભાર સહ,

ફોર્મ જમા કરાવવાનો સમય: ૧૧-૩૦ થી ૨-૦૦ વાગ્યા સુધી

(ડો. વી.કે. યાવડા)

મ. નિયામક, યુવક કલ્યાણ

નોંધ:

- (૧) એપ્લિકેશન ફોર્મમાં એનરોલમેન્ટ નંબર લખવો ફરજિયાત છે.
- (૨) ગુજરાત યુનિવર્સિટીથી વિલગ્ન થયેલ તમામ કોલેજોમાંથી જે વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ ગુજરાત યુનિવર્સિટીમાં થયેલ હશે, તેવા વિદ્યાર્થીઓ જ ઉપરોક્ત શિબિરમાં ભાગ લઈ શકશે.

નકલ રવાના:

- (૧) યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ, વિદ્યાભવનના અધ્યક્ષશ્રીઓ તથા માન્ય સંસ્થાના વડાશ્રીઓ
- (૨) ઇન્ફોર્મેશન સેન્ટરના ઇન્ચાર્જશ્રી - વિદ્યાર્થીઓને માહિતી આપવા સારું.
- (૩) નિયામકશ્રી, રોલવાલા કોમ્પ્યુટર સેન્ટર, ગુજરાત યુનિવર્સિટી, - વિદ્યાર્થીઓ માટે વેબસાઈટ પર અપલોડ કરવા સારું.

GUJARAT UNIVERSITY
DEPARTMENT OF YOUTH WELFARE

APPLICATION FORM

**Paste your recent
passport size
Colour
photograph
signed by
Principal**

CAMP NAME: _____

1. Student Name: _____

2. Student Address: _____

Pin Code: _____

3. Name of the College: _____

4. Enrollment No.: _____ Studying Class: _____

5. Contact No.: (STUDENT MOBILE) _____ (GUARDIAN'S) _____

6. E-mail: **(COMPULSORY)** _____

7. Date of Birth: _____

8. Experience in Adventure/Outdoor Activities: _____

(Signature of the Student)

I hereby certify that the above mentioned information is correct as per our college record and best of my knowledge and belief.

(Signature of the Principal
& College Seal)